

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૧૧/૨૦૧૬ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૪૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૨ કેસ કરી, ૨૧ વ્યક્તિઓને ઝડપી ૧૫૨ લીટર દેશી દારૂ, ૨૮ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૪૧/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૧૪૨/૧૬

વાડજ: રાજગોપાલ રામચરણ કુશ્માહ (રહે. વિવેકાનંદનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડા) એ તા.૧૯/૧૧/૧૬ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૫ થી આજ દિન સુધીના સમયગાળા દરમ્યાન જુના વાડજ કબીર ટેકરી ઝુપડાં વિકાસ સંઘની ઓફીસ-૧૦૩ ખાતે કામ કરતા અજાણ્યા ઈસમોએ રાજગોપાલને ઓફીસે બોલાવી મ્યુનિસિપલ તથા ઔડા માંથી સસ્તા ભાવે મકાન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ રાજગોપાલ પાસેથી રૂપિયા ૬૭,૦૦૦/- મેળવી લઈ મકાન નહીં અપાવી તેમજ પૈસા પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એચ.ખરસાણ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૧૪૩/૧૬

ગોમતીપુર: પ્રકાશકુમાર મહેન્દ્રભાઈ અસારી (રહે.સારંગપુર બ્રીજની બાજુમા મ્યુની હેલ્થ ક્વાર્ટર પાસે) એ તા.૧૯/૧૧/૧૬ નારોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧૦/૧૬ થી તા.૧૭/૧૧/૧૬ (દિવાળીની રજાઓ) દરમ્યાન ગોમતીપુર સારંગપુર બ્રીજની બાજુમા મ્યુની શાળા નં-૪ ના તાળા તોડી અજાણી વ્યક્તિ ત્રણ રૂમ માંથી શેત્રંજી, આસાન પદ્મ, પંખા નંગ-૭, થાળીઓ નંગ-૬૦, બ્લેક બોર્ડ નંગ-૨૫, પાઠ્યપુસ્તક નંગ-૧૦૦ અને નોટબુક નંગ-૬૦ મળી કુલ કિંમત રૂપિયા ૯,૮૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી શ્રી એ.એ.રાઠવા ચલાવે છે.

ગાયકવાડ હવેલી: ઈન્દ્રીશ યુસુફભાઈ નાનાવાલા (રહે.શૈફી મહોલ્લા કાજીના ધાબા આસ્ટોડીયા) એ તા.૧૯/૧૧/૧૬ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૧૧/૧૬ રાતના ૯/૦૦ થી તા.૧૯/૧૧/૧૬ રાતના ૮/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન જમાલપુર, નવી ચાલી ચાર રસ્તા પાસે સ્લોટર હાઉસની બાજુમાં સાયરા મેન્શન બંગ્લોઝ ખાતે પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, ચીજવસ્તુઓ અને રોકડ રૂપિયા ૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૯૨,૭૫૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.યુ.પાડવીચલાવે છે.

પોલીસની ખોટી ઓળખ આપી પૈસા કઢાવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૧૪૪/૧૬

ગાયકવાડ હવેલી: મદનસિંહ સરદારજી બારોટ (ઉ.વ.૩૮) (રહે. વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે સૂર્યમ એલીગંજ ફ્લેટ વસ્ત્રાલ રીંગ રોડ વસ્ત્રાલ) તા.૧૯/૧૧/૧૬ સવારના ૫/૩૦ વાગ્યાના સુમારે રાયખડ વિક્ટોરીયા ગાર્ડન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મરૂન રંગની એકટીવા જેવી ગાડી પર આવેલ (૨૫ થી ૨૮ વર્ષના આશરાના) બે અજાણ્યા ઇસમોએ મદનસિંહને પોલીસના માણસો છીએ તેવી ઓળખ આપી મદનસિંહ પાસે કેટલા પૈસા છે તે ચેક કરવા પડશે તેવુ જણાવી ડરાવી, ધમકાવી વિક્ટોરીયા ગાર્ડનની અંદર થોડે દુર લઈ જઈ મદનસિંહ પાસેથી રૂપિયા ૧,૨૪,૯૦૦/- બળજબરીથી કઢાવી લઈ પલાયન થઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ મદનસિંહ બારોટે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે એસ ડામોર ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૧૪૫/૧૬

મેઘાણીનગર: મનોજ સુરેશભાઈ પાલ (ઉ.વ.૧૮) (રહે.અમરાજીની મોતીજીની ચાલી કલાપીનગર) એ માનસીક બીમારીથી કંટાળી તા.૧૯/૧૧/૧૬ બપોરના ૧/૪૫ થી ૧૫/૦૦ વાગ્યાના દરમ્યાન પોતાના ઘરે લોખંડની પાઇપ સાથે દુપટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ. શ્રી દિલીપસિંહ ગંભીરસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.